

ગોસ્વામી શ્રીહરિરાયાચાર્ય હૃત

કામાખ્યદોષવિવરણ.

મૂળ, અ પાનતરતથા વિવેચન સમેત.

પ્રસિદ્ધ કરનાર

લદ્ધિભાગ માણુષબ્લબદ્ધાસ પારેખ

માણુષની, માદ્રાંકાસ કેરી, અમદાવાદ,

“શ્રી વદ્ધિભાચાર્યજીના જીવનચરિત,”

“શ્રીકૃષ્ણલીલામણ” હંયાદિના કર્તા.

સંશોદિત ઘાણુત્તિ ખીજ.

અથ નવામીત્વન. મર્યાદા - વાધીન રાગયા છે.

અમદાવાદ.

નિષ્પત્તિ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ.

વદ્ધિભાગ ૪૩૨.

સતે ૧૯૭૦.

કિંમત એ રૂપાના.

પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના.

એ માર્ગમાં આનપાનથી દાન્દ્રયોજનાં સારી રીતે પોપળું કરવામાં આવે છે તે માર્ગને પુષ્ટિમાર્ગ કહે છે એમ, શ્રીમહ વદ્વાલાચાર્યજીએ સ્થાપન કરેલા પુષ્ટિ અક્ષિત માર્ગનું અથવા નિર્ગુણ અક્ષિતમાર્ગનું સ્વરૂપ નહિ જાણુનાર; ધણા લોકો સમજે છે. આ જોઈ સમજ હુર થવાની ધ્યાની અગત્ય છે. હજારો વૈષ્ણવો, અને તેમાંના ધણા વિદ્વાનો આ માર્ગમાં હોવા જતાં, આવી ભૂલ કરેલી સમજ આ વીજમી સહી સુધી ચારે એ ખેદારક છે. એ ભૂલ કરેલી સમજ હુર કરવાને વદ્વાલાચાર્યજીના જીવનચરિત્રમાં કંઈક યત્ન કરવામાં આવ્યો છે. એ યત્ન શ્રીમહાચાર્યજીના રચનાઓને આધારે કરવામાં આવ્યો છે.

શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ શ્રીમહલાગવતના ઉળા સ્ક્રિધના ૧૪ માં ક્રોકની સુષ્પોધિની ટીકામાં લખ્યું છે કે.

કામેન કૌવચોભાભ્યામુ કર્મમાર્ગાદિનાશનમ् ॥

ભાવાર્થ—કામ, ક્રોધ અને લોલ એ કુર્મ, જાન અને અક્ષિતમાર્ગનો નાશ કરવાનાણા છે.

નિર્ણય નામના અંથમાં પણ લખ્યું છે કે

દાન્દ્રયાશ્વનિનિગ્રાહ ઇ૦

ભાવાર્થ—દાન્દ્રયોજના અશ્વને રોકવા.

એ રીતે અનેક સ્થળમાં શ્રીમહાચાર્યજીએ કામ અને ક્રોધ વિગેરે ઉપર લખ્યું છે. આ કામાણ્યદોપવિવરણ નામનો અંથ એ લખાણોના વિવરણ ઇય છે.

આ અંથમાં શ્રીહરિરાયજીએ સંપૂર્ણ રીતે ખતાંયું છે કે, પુષ્ટિમાગ વિપયાતમક કે વિપયવર્ધક નથી પણ વિપય છેક છે.

પુષ્ટિલક્ષ્મિમાર્ગનો મૂલ પાયો કામ વાસનાના અલાવ ઉપરજ રચાયેલો છે. આત્મનિવેદન અને તહેદારા પ્રભુસંબંધ એજ એ માર્ગનું પહેલું પગથિયું છે. વિષય-કામ-ના શાશ્વત રૂપ આત્મ નિવેદનથી શરૂ થતો પુષ્ટિલક્ષ્મિમાર્ગ એટલે પ્રભુની રૂપારૂપી સાધનથીજ પ્રભુની સેવા લિદ્ધ કરી પ્રભુ પાદાંબુજમાં જવાને માર્ગ વિષયાત્મક કે વિષયવર્ધક હોઈ રહેશે નહિ.

એ મૂળ પાયા ઉપર રચાયલી દુમારતની લોતો કાળાંતરે આમ તેમ વાંકી વળા ગઈ હોય તો તે માર્ગના જ્ઞાનરૂપ ઓળખાથી સાધીને તેને દુરસ્ત કરી તેના ઉપરની દુમારતને તેના અના સ્વરૂપમાં મૂક્યાની અને ષતાવવાની જરૂર છે.

એક વખત શ્રીમહ વદ્દલભાગ્યજીએ આણા ભરતખંડ ઉપર ધર્મ સંબંધી સામ્રાજ્ય મેળગ્યું હતું, અને એમને તમામ આચાર્યો, પાઠિતો અને રાજાઓ નમતા હતા. એ વાતે આજ પત્રાઈ ગઈ છે એટલુંજ નહિ, પણ એજ આચાર્ય સ્થાપન કરેલા માર્ગ ઉપર આજકાલ અનેક આક્ષેપો કરવામાં આવે છે તેમ છતાં એતન્માર્ગીય વિદ્વાનો સ્વમાર્ગનું સ્વરૂપ સમજવાની અને સમજવાની કાળજી રાખતા નથી, અને વૃત્તિની આતર પારકા કળુઆની વકીલાત કરનારની સંખ્યા ઘણી મંહાઈ હોવા છતાં સત્યના રક્ષણ માટે પોતાના આચાર્યં કે ધર્મની વકીલાત કરવાને તેઓ ઉદ્ઘર્ણીન રહે છે તે સ્મરયની ષલીહારી છે.

આ કામાણ્યહોષવિવરણ નામનો અંથ ઘણી રીતે ઉપયોગી છે. એક તો પુષ્ટિમાર્ગ વિષે લોકોમાં ખોટી સમજણું ફેલાયું છે તે કેટલેક ફરજને આ અંથને લીધે ફૂર થવાનો સંભવ છે. વર્ણી હાલના વખતમાં કામની-વિષયની વૃદ્ધિ થવા માંડી છે તો તેની સામે ધર્મ પોતાનો અવાજ ઉઠાવે તો કંઈ અયોગ્ય નથી.

પહેલાં આપણું જુવન સરદ અને સાહું હતું. લોગ સામની ઘણીજ થોડી અને જુજ અરચથી પુરી પડે એવી હતી:

આજકાલ જીવન કૃતિમ થતું જય છે અને લોગ સામચ્રો ક્રાંતિના મારતી વધતી જય છે. એને પાશ્ચાત્ય બુદ્ધિએ શોધી કાઢેલા અને પુરા પાઉલા પદ્ધાથોં પુષ્ટિ આપતા જય છે. મોહથી અંજાઈ જાણ ને લોગસામચ્રોના પદ્ધાથોં ધર્મદૃષ્ટિથી ગ્રહણ કરવા ચોગ્યા કે નથી એનો વિચાર કરવાની તકનો પણ લાલ લીધા સિવાય તે ગ્રહણ કરવામાં આવે છે. એકનું જોઈ ભીજે તે પ્રમાણે કરે છે. સ્વતંત્રતાના મિષથી આપણે ડગડે ડગડે પરતંત્ર થતા જઈએ છીએ. સહુન કરવાની શક્તિ ઓછો થતી જય છે. અનેક પ્રકારે કામ અને લોગ વધે છે. એવા સમયમાં આવા અંથ ઉપયોગી થવાને સંભવ છે.

આ અંથ સમજાવવા માટે પાંડિતશ્રી લાડલેશજીનો અને સૂચનાએ માટે રા. રા. શાસ્ત્રી મગનલાલ ગણુપતરામનો અમે આલાર માર્ટીએ છીએ.

ખીજ આગૃતિની પ્રસ્તાવના.

ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કહેવાય છે, એમાં જે કામ કહેલો છે તેને! અર્થ સુખ અથવા આત્મસુખ થાય છે. મન સાત્ત્વિક થતાં જ્યારે લैાંકિક વિષયો સંખાંધી તમામ દૃષ્ટિઓ દૂર થાય છે ત્યારે તેમાં જે સુખની પ્રતીતિ થાય છે તેને કામ કહે છે. એ કામ પુરુષાર્થિનું હોઈ સર્વ પ્રકારે હોઈ છે. પણ આ અંથમાંતો કામ શરૂઆત વિષયજ્ઞન્ય સુખના અર્થમાં વાપર્યો છે અને તે પુરુષાર્થ નથી, કેમકે વિષયજ્ઞન્ય કામ સર્વ પ્રાણીઓને સાધારણ છે તેથી તે પુરુષાર્થ હોઈ શકે નહિએ.

કૃષ્ણલલવન, નડિયાદ.
ક્રીનદ્વિલ જથાંત.
૬. સન તા. ૫ મ ૧૯૧૦. }

ગોસ્વામી શ્રીહરિરાયજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.

કામાખ્યદોષવિવરણ નામના અંથના અને બીજા અનેક લઘુ અંથેના રચનાર શ્રીમહ ગોસ્વામી શ્રી હરિરાયજી શ્રીકલ્યાણરાયજીનું જ્યેષ્ઠ પુત્ર હતા. એમના પિતા શ્રીકલ્યાણરાયજી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના પુત્ર શ્રીવિદુતનાથજી (શ્રીગુસાંધજી) ના દ્વિતીય પુત્ર શ્રીગોવિંદરાયજીના પુત્ર હતા. શ્રીહરિરાયજીનો જન્મ સંવત् ૧૬૪૭ના લાદ્રપદ કૃષ્ણ 'પના રોજ થયો હતો. એમના નાના લાઈનું નામ શ્રીગોપેશ્વરજી હતું. શ્રીહરિરાયજીને શ્રીગુસાંધજીના ચાથા પુત્ર શ્રીવિદુત અથવા શ્રીગોકુળનાથજીએ અનુસંધંધ હીક્ષા આપી હતી.

શ્રીહરિરાયજીના જીવનચરિત્ર વિષે ધર્મજી હુકીકત હાલ જાળવામાં નથી. પરંતુ એમણે ૩૦૦થી ૫૦૦ સુધી લઘુઅંથો રચ્યા છે એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. એ લઘુઅંથો ઉપરાંત એમણે વાહના અંથો લગ્ના લોય એમ જણાય છે. એમના અંથો ઉપરથી એમ અનુમાન થાય છે કે એમણે પ્રમાણું કરતાં પ્રમેય ઉપર ધર્માભાર મુક્યો છે. દૈન્ય અને શ્રીનિલચાર્ય ઉપર સંપૂર્ણ આસક્તિ એ એમના લઘુઅંથોનું લક્ષણ છે. એમના અંથો પૈકી કેટલાકને છે એમણે પાતાનું નામ હરિદાસ લખ્યું છે. એમના તમામ અંથો શ્રીઆચાર્યજીમહાપ્રભુજીના અંથો ઉપર વિવરણ દ્વારા એમના લઘુઅંથો પૈકી ૧૧૪ અંથો બૃહત્તોત્ત્ર સરિત્સાગરના દ્વિતીય લાગમાં છપાયા છે, અને બીજાટો હજુ અપ્રસિદ્ધજી છે. એ તમામ અંથો ઉપરોગી છે. એ પૈકી થોડાનાં નામ વાંચનારના ઉપરોગને માટે અમે નીચે આપીએ છીએ.

જન્મ વૈફળ્યનિરૂપણાષ્ટકમ્, દૈન્યાષ્ટકમ્, વિજ્ઞાનિ, પુષ્ટિમાર્ગ લક્ષણાનિ, સ્વમાર્ગમૂલરૂપનિરૂપણ, સર્વત્મભાવનિરૂપણમ્, ભક્તાનાંદુઃસંગવિજ્ઞાનપ્રકારનિરૂપણ, ૪૦

શ્રીહરિતાયજુએ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની બેઠકેની સારી સંભાળ લીધી હતી એમ જગ્યાય છે, તે કારણુથી કેટલીક બેઠકેની સાથે શ્રી આચાર્યજીના નામની સાથે એમનું નામ પણ જોડાયલું સંભળવામાં આવે છે.

શ્રીકૃષ્ણાય નમઃ

॥ અથ કામાર્ઘ્યદોષવિવરણમ् ॥

દોષેષુ પ્રથમઃ કામો વિવિચ્ય વિનિરૂપ્યતે ॥

યસ્મિન્નુત્પત્તે તસ્ય નાશકઃ સર્વથા મતઃ ॥ ? ॥

અર્થ—(સર્વ પ્રકારના) હોષેમાં કામ એ પ્રથમ હોષ છે. તેનું વિવેચન કરીને પૂર્ણ રીતે નિરૂપણ કરવામાં આવે છે. એ હોષ જેમાં ઉત્પત્ત થાય છે તેનો તે નાશ કરે છે એમ સર્વ પ્રકારે માનવામાં આવેલું છે.

વિવેચન—કામ કોધ, લોલ, મોહ, મદ, મત્સર, એમ અનેક હોષો છે તેમાં કામ એ પ્રથમ હોષ કહેવાય છે.

કામ શાબ્દનો સાધારણ અર્થ હુચ્છા છે. તે સ્ત્રીના સમાગમના ઉત્કટ હુચ્છા, વ્યલિચાર વગેરે ૩૬ અર્થમાં વપરાય છે. આ આઓ અંથ વાંચતાં માલમ પડે છે કે એમાં કામ એ રૂભું સ્ત્રીના સમાગમની ઉત્કટ હુચ્છા, વ્યલિચાર તેમજ આજા વિષયોની હુચ્છા વગેરે અર્થમાં વાપરવામાં આવ્યો છે.

આ અંથનું નામ “કામાર્ઘ્યહોષવિવરણ” છે. વિવરણ એટલે ટીકા, ખુલાસો, વિશેષ રીતે કરવામાં આવેલું વર્ણન. એ ઉપરથી જણ્ણાશો કે જે હોષ કામના નામથી ઓળખાય છે તે હોષથી ઉત્પન્ત થતા પરિણમોનું આ અંથમાં સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

કામને મૂલમાં પ્રથમ હોષ એટલા માટે કહેલો છે કે તેનો જન્મ, કોધ, લોલ, મોહ વગેરે તેનાં લાંડુઓના પેહેલો થાયછે. ગીતાલુમાં કહ્યું છે કે:-

વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તે વિષયોમાં સંગ ઉપજે છે. સંગને લીધે તે વિષયો પ્રાપુ કરવાની કામના (કામ) અથવા ધૂચા ઉત્પન્ન થાય છે. એ કામ અથવા ધૂચા ઇણીભૂત કરવાના કામમાં જે વિધનરૂપ માલમ પડે છે તેના ઉપરકોધ ઉત્પન્ન થાય છે. કોધ ઉત્પન્ન થતાં કર્તવ્યાકર્તવ્યને! વિવેક જતો રહે છે અને તેથી સંમોહ થાય છે. મોહ પેઢા થતાં શાસ્ત્રોએ કરેલા ઉપરેશની સ્મૃતિ (યાહૃદાસ્ત) નો નાશ થાય છે, અને ધર્માધર્મ અતાવનાર સ્મૃતિનો નાશ થતાં, સહાયદ્વિનો! નાશ થાય છે અને મુદ્રિનો! નાશ થતાં વેની અંદર કામ ઉત્પન્ન થયો હોય તેનો નાશ થાય છે એટલા માટે ભૂળમાં કામને નાશક કહેલો છે.

કામ એ રજેણુણમાંથી ઉત્પન્ન થાય છે. તે ઉપર અતાવ્યા પ્રમાણે મુદ્રિનો! એટલે જાનનો નાશ કરે છે. માટેજ ભગવાન् ગીતાલુમાં કહે છે કે:-

તસ્માત્ત્વમિદ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્પભ ।
પાપ્માનं પ્રજાહિદ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ् ॥

૩. ૩૧-૪૧

અર્થ—હે ભરત કુળમાં શ્રેષ્ઠ અર્જુન ! એટલા માટે તું પ્રથમ દંનિદ્રિયોને નિયમમાં લાવીને સર્વ પાપના ભૂળભૂત અને જાન અને વિજ્ઞાનના નાશ કરનાર આ (કામ) ને નિર્શ્વય હુણુ.

વિષયાવેશહેતુત્વાદ્વિક્ષેપોત્પત્તિકારણમ् ॥

રજોગુણ સમુત્પત્તો રજઃ પ્રક્ષેપકો સુખે ॥ ૨ ॥

અર્થઃ—તેનું (કામનું) ભૂલ વિષયાવેશ હોવાથી તે વિક્ષેપની ઉત્પત્તિનું કારણ છે. તે રજેણુણમાંથી ઉત્પન્ન થયો છે, અને મોંમાં ધૂળ નાખાવે છે.

વિવેચન—હે મનુષ્ય વિષયોનું ચિંતન કરે છે તેના મન માં તે વિષય પ્રાપુ કરવાની ધૂચા થાય છે, માટે કામનું ભૂળ વિષયાવેશ છે એમ કહેવામાં આંદ્રું છે.

ને વિષય (પરાથ્ર) સારો લાગે તે પ્રાત કરવાની મનમાં પ્રથમ છુંચા ઉત્પન્ન થાય તેને વિષયાવેશ કરું છે. મન જ્યારે અમુક વિષય ઉપર વળે લારે એ કરતાં વધારે સારી વસ્તુ ઉપર જેવી રીતે તે ચાંટવું જોણે તેવી રીતે ન ચાંટે એ હેઠીતુંજ છે.

વિશેપ એટલે ચિત્તની અસ્થિરતા, અને તેથી ઉત્પન્ન થતાં વિધન, પ્રતિબંધ વગેરે. અમુક પહ્યાર્થીની પ્રાપ્તિની છુંચા ઉત્પન્ન થતાં તે છુંચા લગ્બવત્કાર્યમાં વિનાદ્યપ નિવટે એને વિશેપ કરુંવામાં આવે છે.

સત્ત્વ, ૨૪ અને તમ એ ગુણુ ગુણુ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તે જગતમાં સર્વત્ર ઠેકાણે વ્યાપી રહેલા છે. એ ગુણો હેડમાં રહેલા અવ્યય જીવાત્માને બંધન કરે છે (૧૪. ૩૧. ૫). એ ગુણો પૈકી સત્ત્વ ગુણુ નિર્મણ, પ્રકાશક, અને હુઃખથી રહિત હોવાથી જીવાત્માને સુખ અને જ્ઞાનના સંગવડે બંધન કરે છે (૧૪. ૩૧. ૬). આ હેડમાં સર્વ દિનદિનોમાં જ્યારે જ્ઞાનર્દ્યપ પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્ત્વ ગુણુ વિશેપ વધેલો છે એમ જીવનું (૧૪૩૧. ૧૧). મરણ સમયે જેનામાં સત્ત્વ ગુણુની વૃદ્ધિ થઈ હોય તે ઉત્તમ લોકને પ્રાત થાય છે (૧૪.૩૧. ૧૪). સાત્ત્વિક કર્મનું કૃપા સાત્ત્વિક અને નિર્મણ છે (૧૪.૩૧. ૧૬). સત્ત્વગુણુથી જ્ઞાન ઉત્પન્ન થાય છે (૧૪. ૩૧. ૧૭). સત્ત્વગુણુવાળો ઉત્તમ લોકને પામે છે (૧૪. ૩૧. ૧૮).

રન્નેગુણુ તૃપણુ અને સંગની ઉત્પત્તિ કરે છે. તે રાગર્દ્યપ છે. તે જીવાત્માને કર્મના સંગવડે બંધન કરે છે (૧૪. ૩૧. ૭). રન્નેગુણુ કર્મમાં જોડે છે (૧૪. ૩૧. ૯). રન્નેગુણુની વિશેપ વૃદ્ધિ થયે લોલ, પ્રવૃત્તિ, કર્માનો આરંભ, અશાંતિ, અને છુંચા ઉત્પન્ન થાય છે (૧૪. ૩૧. ૧૨). મરતી વખતે જેનામાં રન્નેગુણુની વૃદ્ધિ થયેલી જોવામાં આવતી હોય તે મનુષ્યલોકમાં જન્મ પામે છે (૧૪. ૩૧. ૧૫). રાજ્ય કર્મનું કૃપા હુઃખર્દ્યપ

હાય છે (૧૪ ગી. ૧૬). રણેગુણુથી લોલજ ઉત્પન્ત થાય છે (૧૪ ગી. ૧૭).

તમોગુણુ અજ્ઞાનથી ઉત્પન્ત થાય છે. તે સર્વ પ્રાર્થીઓમાં મોહુ ઉત્પન્ત કરી પ્રમાદ, આગસ અને નિદ્રાવડે તેમને ખંધન કરે છે (૧૪ ગી. ૮). તમોગુણુ જાનને ટંકી હણને પ્રમાદમાંજ જોડે છે. (૧૪ ગી. ૯). તમોગુણુની વિશોપ વૃદ્ધિ થયે અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહુ ઉત્પન્ત થાય છે. (૧૪ ગી. ૧૩). મરતી વખતે જેનામાં તમોગુણુની વૃદ્ધિ થયેલી જણ્ણાતી હોય તે મૂળ ચેનિમાં જન્મ પામે છે. (૧૪ ગી. ૧૫). તામસકર્મનું ઇણ અજ્ઞાન કે (૧૪ ગી. ૧૫). તમોગુણુથી પ્રમાદ, મોહુ અને અજ્ઞાન ઉત્પન્ત થાય છે. (૧૪ ગી. ૧૭). તમોગુણુની વૃત્તિ-માં રહેલાં પ્રાર્થીઓ નીચ ગતિને પામે છે. (૧૪ ગી. ૧૮)

કામના સંબંધમાં રણેગુણુ પ્રચિષ્ઠા અને અશાન્તિ ઉત્પન્ત કરે છે. એ અશાન્તિને લોધે સુખનો પ્રાહુલ્લાલ થતો નથી એટલુંજ નહિ પણ તે અનેક અયોગ્ય કર્મ કરાવે છે. અયોગ્ય કર્મ કરવાથી આણરૂ ઓછી થાય છે માટેજ રણેગુણુથી ઉત્પન્ત થયેલો કામ મુખમાં ધુળ નાખનાર કહેલો છે.

ब्रह्मविशविरोधी च सद्बुद्धर्वाधको मतः ॥

सत्कर्मनाशकः सर्वप्राकृतासक्तिसाधकः ॥ ૩ ॥

અર્થ:—(કામ) એ અજ્ઞાના આવેશનો શાન્ત છે, અને તે સહભુદ્ધિની સ્કુરણા થવામાં ખાધકૃપ માનવામાં આવે છે. તે સત્કર્મનો નાશ કરે છે, અને સર્વ પ્રાકૃત લૈાકિકાસક્તિને ઉત્તેજન આપે છે.

વિવેચન—જેટલે દરજને લૈાકિક વિષયોમાં મન પરોવાયેલું રહે તેણે દરજને અલૈાકિક વિષય—અજ્ઞ અથવા ભગવાન્-માં મન નાજ રહે એ હેઠીતું છે. કામનો વિષય લૈાકિક પદાર્થ હોવાથી અને તે લૈાકિક પદાર્થમાં મન વારંવાર ગુંથાયદું

રહેવાથી લગવાનમાં મન રહેજ નહિં. એટલા માટે કામને લગવાનના આવેશનો શાનુ અથવા વિરોધી ગણેલો છે. શ્રીમહાર્યાર્થ-ચરણ પણ ‘સંન્યાસનિર્ણય’ નામના અંથમાં કહે છે કે વિષયા કાંતદેહાનાં નાવેશાઃ સર્વદા હરેઃ અર્થાતું વેઅના શરીરમાં વિષય આપી ગયો છે તેઓને શ્રીહરિનો આવેશ થવાનો ખીલકુલ અંભવ નથી.

કામી પુરુષને સહભૂદ્ધિ પણ ડોતી નથી. કામાવેશ એ રાજસંગુણનું કાર્ય હોવાથી જે સહભૂદ્ધિની નિર્ગુણુભક્તિ કે-સેવામાં જરૂર છે તે સહભૂદ્ધિને કામાવેશ પ્રતિભંધરૂપ નિવડે છે. સહભૂદ્ધિના અભાવે કામી પુરુષ સત્કર્મનો નાશ કરનાર નીવડે છે. સત્કર્મ એટલે હવિ સેવા, પ્રમુને પ્રસાન્ન કરે એવાં કર્મો, પ્રમુખ પરાયણ કર્મો. કામી પુરુષોથી આવાં કર્મો થર્જ શકતાં નથી, નેથી તેમને એવાં કર્માનો નાશ કરનાર કહેલા છે.

પુષ્ટિ સૃષ્ટિનું પ્રાકૃત્ય ભક્તિપ્રયારથી છે, પ્રાકૃતઆસક્તિ સાધવાને નથી. કામથી તો પ્રાકૃતઆસક્તિ સાધવાનું મન થાય છે, એટલે અપ્રાકૃત લગવદ્ધાસક્તિ સિદ્ધ કરવામાં કામ બાધક છે.

આખા ૧લોકમાં સત્ત અસત્તનો વિવેક ખતાવી અસત્ત કામથી ચિત્તનો રોધ કરી સત્ત શ્રી કૃષ્ણમાં ચિત્તને યોજવું એમ નાર્પથી છે.

ચિત્તાથ્યાદ્રિનિદાનત્વાત् ચિદુત્ત્પત્તૌ ચ બાધકઃ ॥
ભક્તિમાર્ગમહાદૈશ વैરાગ્યાભાવસાધનાત ॥ ૪ ॥

અર્થઃ—કામનું મૂળ કારણ ચિત્તની અશુદ્ધ હોવાથી નિર્પાધિક ચૈતન્યની ઉત્પત્તિમાં તે બાધકરૂપ છે. તે વैરાગ્યના અભાવનું સાધન હોવાથી ભક્તિમાર્ગનો મહાદૈશ (શાનુ) છે.

વિવેચન—આ ૧લોકના પૂર્વાધીમાં શ્રીકૃષ્ણનું ચિત્ત સ્વરૂપ :

નિરૂપણ કરી કામનું અચિતત્વ સ્પષ્ટ કરે છે. પુષ્ટિભક્તિમાં ભગવતું પ્રાકટયજ પરમદૂળ છે. જેમ કાષ્ટમંથનથી કાષ્ટાંતરગત અધિન પ્રકટ થાય છે તેમ વિપ્રયોગાનિદ્વારા હૃદ્રિયાદિ મંથનથી હૃહયાંતરગત પ્રભુનો પ્રાહુર્લીખ થાય છે. પ્રભુના પ્રાહુર્લીખમાં વિપ્રયોગાનિદ્વારા શુદ્ધ હૃદ્યની અપેક્ષા છે. કામીનું હૃદ્ય કામથી માલિન હોય છે. અશુદ્ધ ચિત્તમાં તેનો અધિહેવતા વાસુહેવનો! જ તિરોભાવ, તો પછી ભગવહુપ્રાહુર્લીખનો પ્રસંગજ ક્યા? કામનો જન્મ ચિત્તની અશુદ્ધિમાંથી થાય છે. ચિત્ત શુદ્ધ થવાને મારું ભગવતુકથા-ભગવદ્વાર્તાનું નિત્ય શ્રવણ મનન વગેરેથી ભગવાનમાં નિત્ય ચિત્ત પરોવાએદું રાખવું. તમામ લૈંકિક અનૌકિક કાર્યો ભગવાનને અર્પણ કરવાં, શુદ્ધ મને ભગવાનને અર્પણ કરેલા પહોંચાનુજ લોજનમાં સેવન કરવું, તથા શાન્તિ આદિ સહગુણોનું સેવન વિગેરે કુદ્યાઓથીજ ચિત્તની શુદ્ધિ થાય છે. આ કુદ્યાઓ જે નિત્ય કરતો નથી તેનું ચિત્ત અશુદ્ધ રહે છે, અને તેમ થવાથી તેમાં કામ વિગેરે અનેજ વિકારો પ્રવેશ કરે છે. તેથી ઉપાધિરહિત શ્રીહરિનું ચિંતન થડુ શકતું નથી.

કામને વૈલવની અપેક્ષા હોવાથી તે વૈરાગ્યનો નાશ કરે છે. “વિષય તૃપ્ણા રહિતપણું” એવૈરાગ્ય એમ શ્રીમદાચાર્યજી આજા કરે છે. પોતાનું સુખ વિચારે ત્યાં સુધી હરિભક્તિ થડી શકે નહી મારું કામીને ભક્તિનો દેરી કહેલો છે.

ભક્તિમાર્ગમાં વૈરાગ્યની ખાસ જરૂર છે, કેમકે તેમાં તમામ લૈંકિક પદ્ધાર્યો ઉપરથી ચિત્તને એંચી લઈ માત્ર ભગવાન ઉપરજ રનેહુ કરવાની જરૂર છે. એટલાજ મારું શ્રીમદાચાર્યજી પંચક્ષેપાદિમાં કહે છે:-અનુકૂલબ્ય સંકલપ: પ્રતિકૂલબિસર્જનમુખ્યાત ભગવતું પ્રામણાં અનુકૂલવિષયની સારી કણ્યતા કરવી, એટલે ભગવતું સેવામાં સર્વ વસ્તુનો વિનિયોગ કરવો, અને પ્રતિકૂલ વસ્તુનો ત્યાગ કરવો. (વધારે ખુદીને મારું શ્રી વદ્ધલચરિત્ર પૃષ્ઠ ૧૮૨—૧૮૩ જોવાં).

પૂર્વોકૃત વૈરાગ્ય વિના ભક્તિ સંભવતી નથી, કામીને પૂર્વોકૃત વૈરાગ્ય હોતો નથી એટલે કામીને ભક્તિશત્રુ ગણેલો છે. કામીનું મહિન ચિત્ત વિષયમાં હોય છે એટલે તેનાથી હુરિ સેવા ખનતી નથી. અન્ય સ્થળે શ્રીહરિરાયજી કહે છે કે:—

ચિત્તદોષે કરણ સેવા ચેતસ્તત્પ્રવર્ણ ભવેતુ ॥

શિક્ષાપત્ર ૩૦-૧૩

અર્થ:—ચિત્તમાં દોષ હોય ત્યાં ચિત્તના તત્પ્રવણાદ્ય સેવા શરીરીને હોય, અથોતુ જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ થઈ નથી, અને કામકોધારી તેમાંથા ખસ્યાં નથી, ત્યાં સુધી લગ્વાનની ચિત્ત પ્રવણાદ્ય સેવા ખનતી નથી.

સર્વત્રાપરિતોषશાનેન લોભસમુદ્ભવાત् ॥

યથાકર્થાંચિત્તમાંમુખ્યોદ્રિય વૈમુખ્યકારકઃ ॥ ૬ ॥

અર્થ:—કામમાંથી લોભની ઉત્પત્તિ થવાથી તેને લીધે સર્વત્ર અસંતોષ પ્રસરે છે, અને ક્રેમ તેમ કરીને ધર્દિયે લગ્વાતુ સન્મુખ થઈ હોય તો એ લોભ ધર્દિયેને લગ્વાનથી વિમુખ કરી હો છે.

વિવેચન—મનમાં કામવાસના ઉત્પત્ત થતાં એ વાસનાને સંતોષવાને દ્રવ્યના જડ્ઝર પડે છે એ જડ્ઝર પુરી પાડવા લોભ ઉત્પત્ત થાય છે.

ક્રેમ કામ મનની સામ્યાવસ્થાનો નાશ કરે છે તેમ લોભ પણ મનની સામ્યાવસ્થાનો નાશ કરે છે. તે કરણુથી લોભી મનુષ્ય અસુક કર્મ કર્તાઓ છે કે નહિ એનો વિવેક કરો શકતો નથી.

મનમાં લોભનો ઉદ્ભલવ થતાં સર્વત્ર ઠેકાળે અપરિતોષ (અસંતોષ) ઝેણાય છે. મનમાં અસંતોષ થતાં મુખ્ય ધર્દિયો મત, ચક્ષુ વગેરે લગ્વાનથી વિમુખ થઈ જાય છે, કેમકે લોભી માળુ-

સને એવી શાંતિ કૃયાંથી હોય કે એ ભગવાન સંખાંધી વિચાર કરે, કે ભગવત્કથા વાતાં વાંચે કે સાંલળે.

પુષ્ટિભક્તિમાર્ગમાં તનુજ વિતજ સેવા કરવાથી માનસીસેવા સિદ્ધ થાય છે. વૈરાગ્યજ ન હોવાથી તનની કે મનની સેવા ન સંલવે, પણ વિતજ સેવા સંલવે એમ કદ્વપના કરાય તો તે પણ વ્યર્� છે. કામમાંથી લોલ પ્રકટ થાય છે. લોલ થયો કે અપરિતોષ થાય છે અને અપરિતોષ થતાં વિતજ સેવા કરવામાં પ્રભુનું દ્રોધ્ય પ્રભુને સમર્પવામાં એહ થાય છે, એટલે યથા તથા મન્દિર્ય ભગવત્સન્મુખ થઈ હોય તો પાછી વિમુખ થએ જય છે.

કામલોભૌ હરિપ્રાસિપતિબંધકપર્વતો ॥

તાબુલુંદ્રય ન શક્નાતિ ગંતું કૃષ્ણાંતિકં જનઃ ॥ ૬ ॥

અર્થ:—શ્રીહરિની પ્રાપ્તિ થવામાં કામ અને લોલ એ એ પ્રતિબંધ કરનારા પર્વતો છે. એ પર્વતોને એણાંગિને શ્રીકૃપણની સાન્નિધ્યમાં જવાને મનુષ્ય શક્તિવાન થતો નથી, ૬

કૃપણ સ્થળે પહોંચવાનો માર્ગ સીધો, સરળ અને પ્રતિ બંધ વિનાનો હોય તો તે ઉપરનું પ્રયાણ રહેલાધીથી થઈ રહે શકે અને કે સ્થળે તે માર્ગ લેઈ જતો હોય તે સ્થળે સાધારણ માણુસથી પહોંચી શકાય. પણ રસ્તો ખારા જૈયાવાળો, અને દળ ટેકરાવાળો હોય તો વધારે શ્રમ પડે, અને તે રસ્તો કાપવો મુશ્કેલ પડે. વળી તે ઉપરાંત રસ્તામાં નહી નાળો કે કેતર આવતાં હોય તો તેથી પણ વધારે શક્તિવાનજ તે રસ્તો પ્રયાણ કરી શકે, અને જે રસ્તામાં પર્વતો આવતા હોય તો તો સાધારણ માણુસ માટે તે પર્વતો એણાંગિ તેની બીજી ખાળુએ જવાનું અશક્યજ ખને.

શ્રી હરિરાયજ કહે છે કે ભગવત્પ્રાસિના માર્ગમાં કામ અને લોલ એ રહેયા પર્વતો વચ્ચમાં આવે છે. કામ અહુંતા-

વધ્યક છે, અને કામજન્યલોલ મમતાવર્ધક છે. અહંતા અને મમતા એ બંને લક્ષ્ણમાં પ્રતિબંધક છે, એટલે કામીને લક્ષ્ણમાર્ગ પરવડે નહિ. જેએને ભગવતપ્રાપ્તિની દૃઢા હોય તેએએ કામ અને લોલ બંનેને મનમાંથી ફૂર કરવા જોઈએ.

જ્યાં સુધી મનમાં કામ અને લોલ રહ્યા હોય ત્યાં સુધી ભગવતપ્રાપ્તિની આશા કરવી એ કેવળ વ્યર્થ છે.

અન્યરથી શ્રી હરિશાયજુ કહે છે કે:—

કામાવિષે કોધયુતે સંસારાસક્તિસંયુતે
લોભાડભિભૂતે સતતં ધનાર્જનપરાયણે ॥

શિક્ષાપત્ર ૩૨. ૧.

અર્થ:—જે કામથી આવિષ્ટ છે, કોધયુક્ત છે, સંસારમાં આસક્તિ રાખવાવાળો છે; જે નિરંતર ધન લેણું કરવામાં તત્પર છે (એના હૃદયમાં શ્રી હરિ કહી પણ પ્રવેશ કરતા નથી).

સંસાર મોહહેતુત્વાત् મનોદૂષણસાધનમ्
અતઃસેવાવિરોધી ચ યતઃ સા માનસી મતાઃ ॥૭॥

અર્થ—તે (કામ) સંસારમાં મોહ ઉત્પત્ત કરતા હોવાથી મનને દૂષણવાળું કરવાનું સાધન થાય છે, અને તેથી કરીને તે ભગવત્સેવામાં વિરોધી છે, કેમકે સેવા એ મનનો વિષય માનેલો છે. ૭

વિવેચન—મનમાં કામનો પ્રવેશ થતાં સંસારને વિષે મોહ ઉત્પત્ત થાય છે. મોહ ઉત્પત્ત થતાં મન દૂષણવાળું થાય છે, અર્થાત् તેની નિર્મણતાનો અને તેના ધારનો નાશ થાય છે. શ્રીમહાચાર્યચરણુ સિદ્ધાન્તમુક્તાવલિમાં ભગવતપ્રાપ્તિને માટે સહેલામાં સહેલો ઉપાય સેવા ખતાવે છે. ચેતસ્તત્પ્રવર્ણ સેવા એટલે શ્રી હરિમાં ચિત્ત પરોવલું એને સેવા કહે છે. જે ચિત્તમાં કામનો પ્રવેશ થયો હોય તે ચિત્ત શ્રી હરિમાં પ્રવેશ કરી શકતું નથી, કેમકે કામે તેમાં પ્રવેશ કરવાની રહિત હરી લીધેલો

હોય છે. જેના હાથ પણ લાગેલા હોય તે માણુસ કેમ ચાલી કે કામ કરી શકતો નથી તેમ જે મન કામ, કોધ, મોહાદિથી ફુલિત થયેલું હોય તે મન ભગવાનમાં પ્રવેશ કરી શકતું નથી.

સેવા એ માનસીપ્રયોગ છે. શ્રીહરિમાં પ્રવેશ કરવાને ફુલિત મન અશક્તિવાન् હોવાથી કામ અને તેના અનુયાયીએને સેવાના વિરોધી કહેવામાં આવ્યા છે.

અન્ય સ્થળે શ્રીહરિરાયજી કહે છે કે,

સ્મર્ત્તવ્યઃ સર્વદા કૃષ્ણો વિસ્મર્ત્તવ્યં જગત્ પુનઃ ॥

પ્રપંચસ્પરણે કૃષ્ણસ્મृતિ નૈવભવેદિતિ ॥

શિક્ષાપત્ર ૩૦-૧.

અર્થઃ—સર્વદા શ્રીકૃષ્ણ સમરણુ કરવા ચોગ્ય છે, અને જગત્ વિસ્મરણુ કરવા ચોગ્ય છે. જ્યાંસુધી પ્રપંચનુ સમરણુ હોય ત્યાંસુધી શ્રીકૃષ્ણની ઘૂર્ણિતિ હોછ શકે નહિ.

નિરોધસ્ય મહાञ્ચુત્તુરન્યસ્ફૂર્તિકરો યતઃ ॥

ગુણગાનસપત્નોડપિ ન રોચંતે ગુણા યતઃ ॥ ૮ ॥

અર્થઃ—કામ એ નિરોધનો મહાન् શત્રુ છે કેમકે તેનાથા અનેક પ્રકારની વૃત્તિઓનું સ્કૂરણુ થાય છે. શ્રી હરિના શુણુ ગાનનો પણ તે શત્રુ છે અને તેથી કરીને તેને (કામીપુરુષને), શ્રી હરિના શુણુનું ગાન ઝયતું નથી. ૮

વિવેચન—નિરોધલક્ષણ નામના શ્રીમદ્બાચાર્યજીએ રચેલા ગ્રંથ ઉપરથી જણાય છે કે (જુઓ શ્રી વાણિભવરિત) શ્રી હરિના શુણુ ગાવામાં નિરંતર મનને રોકવું અને તમામ જ્ઞાનેન્દ્રિયો, કર્મન્દ્રિયો, મન અને હેઠના સર્વ વ્યાપાર ભગવાન પરત્વેજ રાખવા, એનું નામ નિરોધ છે. કામ એ આવા પ્રકારના નિરોધનો શત્રુ છે, કેમકે તેને ભગવાનના શુણુ ગાનની સ્કુર્તિ થતી નથી પણ અન્ય વિષયોની સ્કુર્તિ થાય છે.

કામી મતુષ્ય તો નિરંતર પોતાના કામના વિષયનું, તેમાં જોઈની સામચ્ચી અને સાધનોનુંજ ગાન કરે છે. આવા કનિષ્ઠ પ્રકારનાં ગુણુગાનમાં ગુંથાયદું મન શ્રીહરિના ગુણુગાનમાં પ્રવેશ કરી શકેજ નહીં. એટલા માટે કામને નિરોધનો મહાન् શરૂ કરેલો છે. કીને શોકય ન અમે તેમ કામને પ્રભુના ગુણુગાનિષ્પી નિરોધ ગમતો નથી, અને તેજ કારણુથી તેમાં એને ઝડિય ઉત્પન્ન થતી નથી.

નિરોધ એટલે માનસીસેવા. પ્રપંચવિસ્મૃતિપૂર્વક લગ્વદાસક્રિય એજ નિરોધ છે. પ્રપંચવિસ્મૃતિ એ નિરોધનું પૂર્વ અંગ છે. કામીને પ્રપંચનો વિસ્મૃતિ ન હોય. લગ્વદાસક્રિય એ નિરોધનું ઉત્તર અંગ છે. ગુણુગાન લિના લગ્વદાસક્રિય થતી નથી. કામી કામ્યપદાર્થના ગુણુગાનમાં ઉન્મત્ત હોય છે; તો તે શ્રીહરિનું ગુણુગાન કયાંથી કરે ?

વैરाग्यसाधકાઃ સર્વे કામિનસ્તે કર્થંપ્રિયાઃ ॥

અત એવ હિ દૃશ્યંતે ગુણશ્રવણવૈરિણઃ ॥ ૧. ॥

અર્થ:- ઉપર કહેલા શ્રી લગ્વાનના સર્વગુણો વैરાગ્ય ઉત્પન્ન કરવાના સાધનરૂપ છે, તેથી કરીને શ્રી હરિના ગુણોનું ગાન કામીપુરુષને કેમ પ્રિય લાગે ? એ પ્રમાણે હોવાથી કામી પુરુષો લગ્વાનના ગુણુશ્રવણને વિષે દુઃમન હોય એવા જણાયછે.

વિવેચન- શ્રી હરિનું ગુણુગાન કરવાનો મુખ્ય હેતુ તમામ લોકિક પદાર્થો ઉપરથી મનને ખસેડી માત્ર શ્રીહરિના ઉપર તેને ચાટાડવું એ છે, એમ કરવાનો ધર્ષણો મહાવરો થવાથી પ્રભુ ઉપર સ્નેહ ઉત્પન્ન થાય છે અને તે સ્નેહ (રાગવિનાશઃ) રાગને તોડનાર હોવાથી પ્રભુમાં આસક્રિય ઉત્પન્ન કરી (ગૃહારુચિઃ) ધર શ્રી પુત્ર વગેરે ને વિષે અર્દચિ પેઢા કરે છે, અર્થાત્ વैરાગ્ય ઉત્પન્ન કરે છે (જુઓ લક્ષ્મિવિધિની શ્લોક ૪). એ ઉપરથી જણાશે કે પ્રભુના ગુણુગાનથી વैરાગ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ

કામી મતુષ્યને તમામ મનોવ્યાપાર એ સધળા લૈાકિક પહાર્યો
ઉપર પ્રીતિની વૃદ્ધિ કરવાના હેતુવાળો હોવાથી તે પ્રભુના શુણ
અવણુનો શત્રુ જોવામાં આવે છે.

સારાંશ એ છે કે ભગવદ્ગુણુગાન કરવામાં આવે તો ભગ-
વાન્ પ્રપંચરાગના વૈરી હોવાથી વૈરાગ્ય સિદ્ધ કરી હે છે, પણ
કામીને તો વૈરાગ્ય વિષતુદ્ય છે મારે કામીને ભગવદ્ગુણ કેમ
પ્રિય હોઈ શકે ? તે કારણથી કામીને શુણુ અવણુના વૈરી કહે-
વામાં આવે છે.

કોધઃસ્વકાર્યકરણાલ્લોભઃ પ્રાપ્ત્યાપિ શામ્યતિ ॥

બૃતહોમે બહિરિવ કામો ભોગેન વર્ધતે ॥ ૧૦ ॥

અર્થ:-—પોતે ધારેલું કાર્ય સિદ્ધ થયેથી કોધ શાન્ત થાય
છે. હચ્છિત પદાર્થ પ્રાપુ થયેથી લોલની શાન્તિ થાય છે, પરંતુ
ધી હોમવાથી જેમ અજિન વૃદ્ધિને પામે તેમ કામ લોગથી
વૃદ્ધિને પામે છે. ૧૦

વિવેચન—અમુક માણુસ અમુક રીતે વર્તતો ન હોય તે
કારણથી આપણુને તેના ઉપર કોધ થાય તો તે કોધ તે માણુસ
આપણા ધાર્યા પ્રમાણે વત્યેથી ઉત્તરી જાય છે. આપણુને અમુક
પદાર્થ જોઈતો હોય, અને કેઈ માણુસ આપણુને તે પદાર્થ લેવા
હેતો ન હોય તેથી આપણે તેના ઉપર ગુસ્સે થડુએ, પણ એ
ગુસ્સો એ પદાર્થ આપણુને લેવા હીધાથી ઉત્તરી જાય છે.

જે કારણથી કોધ ઉત્પન્ન થયો હોય તે કારણ ફરજ થતાં
કોધની શાન્તિ થાય છે, એજ પ્રમાણે લોલનું પણ છે, પરંતુ
કામની ખાખતમાં તેમ થતું નથી.

અજિનમાં ધી હોમવાથી અજિન વધારે પ્રદીપ થાય છે.
તેવીજ રીતે જેમ જેમ કામ તૃપુ કરવામાં કે લોગવવામાં આવે
જી તેમ તેમ તે વૃદ્ધિને પામે છે. એ કારણુને લીધે લોલ અને
કોધના કરતાં કામને પ્રભુપ્રાપ્તિના વિષયમાં વધારે ખળવાન
શત્રુ અણુવામાં આવે છે.

કામેન નાશિતમતિઃ પ્રતિષિદ્ધે પ્રવર્તતે ।
અગમ્યાગમને ચૌર્યે તથૈવાભક્ષ્યભક્ષણે ॥૧૧॥

અર્થ:—કામથી હુણુયલી બુદ્ધિ શાસ્ત્રોએ નિષિદ્ધ કરેલા કર્મોમાં, અગમ્યગમન, ચારી અને અલક્ષ્યભક્ષણમાં પ્રવતે છે.

વિવેચન—કામથી બુદ્ધિ શરીરિટે હુણું જાય છે તે પૂર્વે પહેલા શ્લોક નીચેના વિવેચનમાં સમજવવામાં આવ્યું છે. એ હુણું ગયેલી બુદ્ધિ સારા અને શાસ્ત્રવિહિત કર્મોમાં ઇચ્છિવાળી હોતી નથી, પણ શાસ્ત્રોએ મના કરેલાં કર્મોમાં જોડાય છે. એવી બુદ્ધિવાળો કામીમાણુસ વેચોની સાથેનો આડો વ્યવહાર શાસ્ત્રોએ તેમજ ઉત્તમ ક્ષાક્રિક નીતિ વ્યવહારે નિષેધ કરેલો છે તેચોની સાથે સમાગમ કરવાને અસ્તકો નથી. પાતાની પાશાં વાસનાઓને સંતોષવા કામી ચારી, ઠગાઈ, તેમજ અલક્ષ્ય (ન ખાવા લાયક વસ્તુ) નું લક્ષણું કરે છે.

લક્ષણી બુદ્ધિ અપ્રતિષિદ્ધ પદાર્થ તરફ વળે છે. અગવ-
-માદિરાદીજ લક્ષણાં ગંતવ્યસ્થાન છે. લક્ષણ ચોર્યાહિ દોષથી રહિત હોય છે, અને અગવત્સમાપ્તિ પદાર્થનું લક્ષણું કરે છે. કામીને આ ચારે પાદવતાં નથી.

યત ઉત્પવ્યતે ક્રોધો મહદ્દોહસમુદ્ભવः ।
લોભોડપિ જાયતે તસ્માત् સ ચાર્થવિપયો ભવેત् ॥૧૨॥

અર્થ:—કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને તેથી રહેઠાની સાથે વિરોધ પેદા થાય છે, કામમાંથી લોભ પણ ઉત્પન્ન થાય છે, અને અર્થ અથવા દ્રવ્ય એ લોભનો વિષય થાય છે.

વિવેચન—કામને લીધે બુદ્ધિ હીન થતાં કામી માણુસ ધૂચિત વિષયની યોગ્યાયોગ્યતા તપાસ્તી શકતો નથી, અને તેથી મોટા માણુસો સાથે વેર થાય છે. કેટલીક વખત ચાકરે, ખવાસ કે નોકરને પાતાના અજદાતાની કેછી સર્જી સ્વી તરફ

હુર્મતિ ઉત્પત્ત થતાં વિરોધ ઉત્પત્ત થાય છે, અને એ વિરોધનું પરિણામ વળતે મેતમાં આવે છે. કામ પૂર્ણ કરવાનાં સાહિત્યો પ્રાપું કરવામાં દ્રોય મહુદગાર થઈ પડે છે, તેથી કામ-માંથી દ્રોય પ્રાપું કરવા ઇપ લોલની ઉત્પત્તિ થાય છે. ચોગ્ય માર્ગે દ્રોય પ્રાપું કરવાને કામી માણુસ અશક્ત હોય છે ત્યારે તે પ્રાપું કરવાને તે બમે તેવાં અચોગ્ય કર્મો કરવાને અચક્તતો નથી.

કામને લીધે મહોટા પુરુષો સાથે વૈર ઉત્પત્ત થયાના હું-નારો હાખલા પુરાણો અને ઇતિહાસો ઉપરથી મળી આવે છે. એ બાખતનો જથાખંધ પુરાવો ઝાજફારી અહાલતો હરહુમ્મેશ પુરો પાડે છે.

દ્રોયમાં કેટલા અનર્થ રહેતા છે તે નીચેના ૧૩૦ાંથી બાતાવવામાં આવે છે.

સોऽર्थः पंचदशानर्थमूलं तत्र प्रवर्तते ।

कामेनैव हि कार्पण्यं कामिनीषु सतां मतम् ॥? ૩॥

અર્થઃ—તે અર્થ (દ્રોય) (નીચે જણાવેલા) પંદર અનર્થનો ભૂણિપ હોવાથી સર્વ અનર્થો કામી પુરુષમાં પ્રવેશ કરે છે. કામને લીધે કામિનીએ પરત્વે કામીપુરુષને દીનતા (કાર્પણ્ય) પ્રાપું થાય છે એમ મહોટા પુરુષોએ માનેલું છે.

स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः ।

मेदो वैरमविश्वासः संस्पर्धा व्यसनानिच ॥

અર્થઃ—૧ સ્તેય (ચારી), ૨ છિંસા, ૩ અનૃત (જીહું ખાલવું), ૪ દંભ (ડોળ), ૫ કામ, ૬ કોધ. ૭ સ્મય (ગર્વ) < મદ, ૮ લેદ, ૧૦ વૈર, ૧૧ અવિશ્વાસ, ૧૨ સંસ્પર્ધા (દૃષ્ટિઓ) ૧૩ સુરત, ૧૪ ધૂત ૧૫ મધ.

વિવેચનઃ—વ્યસનોમાં સુરત, ધૂત અને મધનો સમાસ થાયછે.

ઉપર કહેલા પંદર અનર્થો દ્રોયમાં રહેતા હોવાથી કામી-પુરુષોમાં એ સર્વ અનર્થો પ્રવેશ કરે છે.

કામીમતુણ્યો જે ખીને વિષે આસક્તિવાળા હોય છે તે ખીએ પરતે દાલોડહં તવાસિમ (હું તારે દાસ છું) એ પ્રમાણે રહે છે. કામને લીધે તેઓનામાં એટલી ખંડી દીનતા (કાર્પણ્ય) વ્યાપી ગઈ હોય છે કે રખેને મને આ સી છાડી હેશે કે તે નારાજ થશે અને તેથી રહારા વિલાસમાં ખલેલ પડશે, એ જયથી તેઓ ખીએની અપમાનકારક વાણી અને વર્તાણુંક મુંગે મોઢે સહુન કરે છે.

કામમાંથી લોલ ઉત્પન્ન થાય છે, અને લોલ અર્થવિષયક છે એમ પૂર્વે કહેવામાં આવ્યું છે. હુવે અર્થના સ્વરૂપનો વિચાર કરતાં નિશ્ચય થાય છે કે અર્થ એજ અનર્થ રૂપ છે.

મોટા મોટા ભગવદીયોનો પણ કામે નાશ કરી નાંખ્યો એ સ્પષ્ટ કરી તેના પ્રાણવિદ્યનું હુવે નિરૂપણ કરવામાં આવે છે.

પ્રાર્થયંતિ યતસ્તુચ્છાં પ્રવેશ્ય બદ્ને કરમ्

પ્રિયવ્રતસુતો રાજા ભ્રષ્ટ: કામેન સત્કલાત् ॥ ૧૪ ॥

આગ્નીધ્રો વિષયાવેશાદુર્વશીલોકમાપિતઃ ॥

કામેન કશ્યપો દૈત્યોત્પાદને હેતુતાં ગતઃ ॥ ૧૫ ॥

નિવૃત્તસંધ્યાનિયમ: પત્નિપ્રાર્થનમોહિતઃ ॥

કામેન ચ શિવ: કૃષ્ણયુવતીરૂપવંચિતઃ ॥ ૧૬ ॥

અર્થ:—કામને લીધે કામી લોકો તુચ્છ ખીએનાં મોંમાં આંગળી ઘાલી તેમની પ્રાર્થના કરે છે. કામને લીધે પ્રિયવ્રત રાજનો પુત્ર આગ્નીધ્ર ભગવત્પ્રામિરૂપ સત્કલથી ભ્રષ્ટ થયો હતો અને તેને વિષયાવેશ હોવાથી તે ઉર્વશીના લોકને પામ્યો હતો. કર્શયપ પ્રજનપતિ જે સંધ્યાની ડિયાઓથી પરવાર્ય હતા તે પોતાની પત્નિની પ્રાર્થનાથી મોહિત થઈને કામને લીધે હૈત્યોની (હિરણ્યકશ અને હિરણ્યકશિપુની) ઉત્પત્તિના કારણું ભૂત થયા હતા. તેમજ કામને લીધે શ્રીમહાદેવજી શ્રીકૃષ્ણના મોહિની સ્વરૂપથી મોહ પામીને છેતરાયા હતા.

વિવેચન:- કામને લીધે આમી મનુષ્યો હીન થઈ પોતાની મોહમૂર્તિ મય તુચ્છ અથવા હુલકી સ્વીચ્છાને મહેંમાં તરણું ઘાલી કરગરે છે; અર્થાત् તેમને ખુશી રાખવાને પોતે પોતાનાં માન, આખરું, પદવી, કર્તાવ્ય તમામને ભૂકી જઈ માત્ર તેમની ભરજી સંપાદન કરવાની ખાતર તેમની ખુશામત કરે છે. કામને અભાવે વે જે સ્વીચ્છા બિલકુલ માન આપવાને પાત્ર ન હોય એવી હુલકી નિર્લંઘ અને ભ્રમણ સ્વીચ્છા પ્રત્યે કામી મનુષ્યોની આવી લક્ષ્ણ થઈ જવાથી તેમનાં ઐહિક અને પારકૌંડિક કદ્યાણુનો સર્વ પ્રકારે નાશ થાય છે.

કામની સત્તા માત્ર રેંજુપેંજુ માણુસાં ઉપર ચાલે છે એમ નથી, પણ તે મહાત્માઓ અને હેવોના ઉપર પણ ચાલે છે એમ એવા વાતાવરા શ્રી હરિરાયજી પૌરાણિક દૃષ્ટાન્તો આપે છે.

આગનીધ્રરાજા:- આગનીધ્રરાજ પ્રિયત્રતનો પુત્ર હતો. તે ધર્મ તરફ દૃષ્ટિ રાખીને જંબુદ્ધિપની પ્રણાનું પેટની પ્રણ પેઠે પાલન કરતો હતો. તેને ક્રૈદ્ધક હિવસે પુત્રની છુચ્છા થઈ, તેથી તે મંદરાચલની ગુઝ્ઝામાં ગયો અને ત્યાં પ્રણાપત્રિયોના પતિ લગવાનું અદ્ધાનું તપક્ષર્યાવડે આરાધન કરવા મંડયો. એ તપક્ષર્યા ન્લેદુને અદ્ધાળુએ પૂર્વચિત્તિ નામની અસરાને તેની પાસે મોકલી. તેના નૂરુરનો મનોહર અણુકાર સાંભળી આગનીધ્રની સમાધિ છુટી ગઈ. તે અસરાનાં આનંદપ્રદ ગતિ, વિહાર, લબ્જા, વિનયપૂર્વક ઈક્ષણું (લેલું), મધુર ભાષણ અને શરીરના સુંદર અલિનય (લટકાં) આ સર્વ કામોદીપક હતાં. આવી મનોહારી અસરાને ન્લેદું આગનીધ્રરાજાએ તેને આધીન થઈ જઈ કહ્યું કે:- હું તમોને અનુકૂળ થયો છું માટે તમારું મન હોય ત્યાં લલે મને લેઈ જાયો અને તમારી સખીએ પણ મને અનુકૂળ થાયો તથા હરિણીએ જમણી તરફ ઉતરો.

ભુદ્ધ, શીલ, ઇપ, વૈવન, લક્ષ્મી અને ઉદ્ધારતાથી આ-

કિમ મનવાળી પૂર્વચિત્તિ અસરા તે મહા શૂરવીર આણની-
ધરાજની સાથે રહીને હુલરો વર્ષ સુધી પૃથ્વી તથા સ્વર્ગના
લોગ લોગવવા લાગી. રાજ આણનીએ એ ખોને વિષે નાલિ
વગેરે નવ પુત્રો ઉત્પન્ન કર્યા. એ નવ પુત્રોને રાજનાજ ધરમાં
મુકીદઈ પૂર્વચિત્તિ પાછી અદ્ભુતાની પાસે ગઈ. આણનીધરાજ કા-
મનો ઉપલોગ કર્યા છતાં તૃત્મ થયો નહોંતો, અને પ્રતિહિન તે
અસરાનેજ આંધક માનતો હતો. તેથી તે વેહોક્તા કર્મો કરીને
અસરાના લોકમાંજ ગયો. આ કુથા શ્રીમહલાગવતના પંચમ
સ્કંધના બીજા અધ્યાયમાં છે.

અદ્ભુત રજેગુણી હોવાથી આણનીધરાજને રજેગુણુથી ઉત્પન્ન
થયેલા કામની પ્રાપ્તિ થઈ. એ વાત ઉપરથી જાણુવું જોઈએ કે
રજેગુણી અદ્ભુત કે તમોગુણપ્રધાન ઝડની ઉપાસના ભગવત-
પ્રાપ્તિના કાર્યમાં ચોણ્ય નથી, પણ નિર્જણ શ્રી કૃષ્ણ પરમાત્મા-
નીજ ઉપાસના કર્તાંય છે.

કશ્યપક્રથિની કુથા:—કશ્યપક્રથિ મરીચિદ્વિષિના પુત્ર હતા.
એ પ્રભાપતિઓમાંના એક હતા. એ દક્ષ પ્રભાપતિની તેર દીક-
રીએ વેરે પરણ્યા હતા. આ તેર પૈકીની એક દિતિ હતી.
એક દિવસે સંતાનની દુદ્ધાવાળાં અને કામથી પીડાયલાં દિતિ
યજશાળામાં એકાશચિત્તથી એઠેલા પોતાના લર્તા કશ્યપની
પાસે જઈ કહેવા લાગ્યાં કે હે વિદ્ધન! મહોન્મત્ત હાથી જેમ
કેળને બળાત્કારથી પીડ તેમજ આ કામહેવ હુથમાં ધનુષ લેમ
પોતાનું પરાક્રમ પ્રકૃટ કરીને તમારે મારે મને હીનને ખહુજ
શીડ છે. મારે હે નાથ, પુત્રવાળી શોકયોની સંપત્તિથી બળો
મરતી એવી જે હું તેના ઉપર આપ અનુશ્રહ કરો, અને તમારું
કૃદ્યાણું થાએ. જે સ્ત્રીએને પતિના તરફથી ખહુજ માન મળો
છે, તથા તપસ્વી મુનિએ જે સ્ત્રીએમાંથી પ્રભાર્યે ઉત્પન્ન
થાય છે તે સ્ત્રીએનો યશ લોકોમાં ઝેલાય છે. મારે મારી
કામના પૂર્ણ કરો. આ પ્રમાણે કામની વૃદ્ધિથી મોહિત થયેલી

કૃપણુ દિતિનો તે નિષિદ્ધ કર્મમાં આગ્રહ જાણીને કશ્યપત્રવિએ
આવી હૈવને પ્રાણામ કરી દિતિની મનકામના પૂર્ણ કરી. પછી
સ્નાન કરી પ્રાણાયામ કરી, મૈન ધારણ કરી તે ઋષિ શુદ્ધ
સત્ત્વમૂર્તિ એવા જ્યોતિર્મય પ્રજ્ઞાનું ધ્યાન કરતા ગાયત્રીનો જ્પ
કરવા લાગ્યા. લાર પછી દિતિ પોતાનાં નિહિત કર્મથી લબ્ધ
ગયાં અને પોતાના પતિની પાસે આવી આ પ્રમાણે કહેવા
લાગ્યાં:—

હુ પ્રજ્ઞાન! મેં નેનો અપરાધ કર્યો છે તે દૃદ્રહેવ સર્વ
પ્રાણીએના પતિ છે. તે ભૂતોના સ્વામી મહાહેવ આ મારા
ગર્ભનો નાશ કરશો મા. નિર્હય પુરુષોના ઉપર હ્યા કરવા ચોણ્ય
શંકર અમો સ્વી જતિ ઉપર પ્રસંગ થાઓ.

સાયંકાળના નિયમને પૂર્ણ કરીને કશ્યપત્રવિ ઐદ્યાઃ “હુ
કશ્યાણી ! હુ કેાધી સ્વી ! તારા મનના અપવિત્રપણુને લીધે,
સંધ્યાકાળરૂપી દુષ્ટ સમયને લીધે, મારી આજા ઉદ્દલંઘન કર-
વાને લીધે, અને દૃદ્રના સેવકેનો અપરાધ કરવાને લીધે તારા
ઉદ્દરમાં અધમ તથા દુષ્ટ એ પુત્ર ઉત્પન્ન થશે અને ભૂલોક સ-
હિત આ ત્રણે લોકને વારંવાર દુખી કરશો, અને જ્યારે ધર્ણો
નુલમ થશે ત્યારે લગવાનું અવતાર ધારણ કરી તારા પુત્રોનો
નાશ કરશો.”

તે પછી કેટલેક કાળે હિરણ્યકશિપુ એ
એ હૈત્યોને દિતિએ જન્મ આપ્યો. (લાગ્વિત સુંધ ૩. અધ્યાય
૧૪ થી ૧૭)

એ પ્રમાણે કામને લીધે કશ્યપત્રવિ પણ હૈત્યોરૂપી અ-
નિષ્ટ પરંપરાની ઉત્પત્તિના કારણુભૂત થયા હતા.

શ્રી મહાહેવજીની કથા:—શ્રીહરિએ ખોના રૂપથી હૈત્યોને
મોહિત કરી હૈવોને અમૃત પાણું. આ વાત સાંલળીને જ્યાં
લગવાનું ખિરાજતા હતા ત્યાં આગળ તેમનું સ્વરૂપ જેવા માટે

મહાદેવ પાર્વતી સાથે નંદીશ્વર ઉપર એસી પોતાના પાર્વહોથી વિટળાઈને ગયા. લગ્વાને શાંકરનો તથા પાર્વતીનો આદર સાથે સરકાર કર્યો. શાંકરે પણ સારી રીતે એડા પછી લગ્વાનનો સામો સરકાર કર્યો, અને મંદમંદ હુસતાં નીચે પ્રમાણે કહ્યું:—
 “હે દેવના દેવ ! હે જગત્ વ્યાપક ! હે જગતના સ્વામિ !
 હે જગન્મય ! તમે સર્વ પદાર્થાના આત્માદૃપ છો, કારણુર્દૃપ છો,
 અને ઈશ્વર છો. જગતમાં જે આદિ, અંત અને મધ્ય છે તે
 તમારામાં નથી. દૃશ્ય-દૃષ્ટા અને લોભ્ય-લોક્તા જેનાથી જીવાં
 નથી તે સાથે અને ચૈતન્યધન પરબ્રહ્મ આપ છો. મોક્ષની કુર્ચા-
 વાળા સુનિશ્ચો નિષ્કામ થધુને આ લોકની તથા પરકોકની આ-
 સાક્તા છોડી તમારાંજ ચરણુરવિદની ઉપાસના કરે છે. તમે
 પરપૂર્ણાંછો, સર્વ સુખરૂપછો, ગુણરહિતછો તેથી શોક વિનાના
 છો, અને તેથીજ વિકાર વિનાના છો, આનંદસ્વરૂપ છો, સર્વ
 સ્વરૂપ છો, અને સર્વથી લિઙ્ગ એવા પરબ્રહ્મ છો, તથાપિ આ
 જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છો. જીવોને જીવાં
 જીવાં ફૂળ આપનાર છો. તમારે કોઈની પણ અપેક્ષા નથી.
 પરંતુ જીવોને તમારી અપેક્ષા છે; મારે તમારું જે ઈશ્વર્ય છે
 તે લકૃતોના અનુશ્રહને માટે છે પણ તમારે પોતાને માટે નથી.
 કુંડળ કડાંતા આકારમાં બનેલું સોનું, તથા વિશેષ આકાર વિ-
 નાનું સોનું એ બન્ને જેમ એકજ છે તેમજ કાર્ય-કારણુર્દૃપ દેંત
 તથા તેનું પરમ કારણ તમે એકજ છો. ગુણોવડે અનેક લીલા
 કરનાર આપના બીજા અવતારો મેં જોયા છે. હુદે આપે જે
 મોહિની સ્વરૂપ ધર્યું હતું તે સ્વરૂપ જેવાની ઈચ્છાથી અમે આવ્યાં
 છીએ, કારણ કે અમને તે સ્વરૂપ જેવાની અત્યંત ઉત્કંઢા છે.”

આ પ્રમાણે શાંકરે લગ્વાન વિષણુની પ્રાર્થના કરી એટલે
 લગ્વાન ભાવવડે ગંભીરતાથી હુસીને શાંકર પ્રત્યે કહેવા લાગ્યા:-
 જ્યારે હૈત્યો અમૃતકલશ લેઈ ગયા ત્યારે દેવતાઓનાં કાર્ય
 કરનારા મેં, હૈત્યોને મોહિત કરવા માટે, સ્વીનું રૂપ ધારણ કર્યું

હતું. હે દેવ શ્રેપુ ! તે સ્વરૂપ કે જે કામિયો બહુ ઉત્તમ માને
છે અને જેમાંથી કામની ઉત્પત્તિ થાય છે તે મોહિનીરૂપ તમે
લેવાની ધૂચાવાળા છો તો તમને હું હેખાડું છું. ”

આ પ્રમાણે કહેતાંવાર ભગવાન લાંજ અદૃશ્ય થઈ ગયા
અને શાંકર ઉમાની સાથે ચારે તરફ દાખિલ કરતા ઐસી રહ્યા.
એટલામાં શાંકરે લાં આગળ એક વિચિત્ર જાતના પુષ્પોવાળાં
તથા નવપત્રીઓ રાતાં પાંડાંવાળાં વૃક્ષોનું એક ઉપવન દીકું અને
તે ઉપવનમાં દડાની રમત રમતી એક સુંદર સ્વીને દીઠી. તે
જમણા હાથથી દડાને ઉછાળતી હતી અને પોતાની લીલાથી
જગતને મોહિત કરતી હતી. લાબણ્યમથી, મનોહારી એ રમણીને
સિમતહુસ્ય કરતી, અને હૃદય-વેંધક કરાશ્ના મારતી જોઈને શાંકર
તેના ઉપર મોહિત થઈ ગયા. તેણું શાંકરના વિવેકનો નાશ
કર્યો તેથી કામથી વિહુવળ એવા શાંકર પાર્વતીના હેખતાંજ
લંજન મૂકુને તેની પાછળ હોડયા. એ પ્રમાણે શ્રી મહાહેવજુ
પણું કામથી પરાજ્ય પામ્યા હતા.

**કામેન નારદઃ ષष્ઠિપુત્રાનજનયત્સ્વતः
ગર્વાભાવાય હરિણ દત્તઃ કામો મહાશનઃ ॥ ૧૭**

અર્થ:-—કામથી હોરાધને નારદજુએ પોતાના શરીરથી સાડ
પુત્રો ઉત્પન્ન કર્યા હતા. શ્રી હરિએ મનુષ્યનો ગર્વ ઉતારવાને
મારે તેમના પાછળ ભર્વલક્ષી કામને મુક્યો છે.

વિવેચન—શ્રી નારદજુને ગર્વ થયો કે મારા સમાન કોઈ
અયવહલકૃત નથી. એમના ગર્વનું નિવારણ કરવા શ્રી હરિએ
મહાશન કામ નારદજુમાં મુક્યો. કામને વિવશ થઈ નારદજુએ
૬૦ પુત્રોને જન્મ આપ્યો.

માણસને ગર્વ ન રહે એને મારે પ્રભુએ કામને મુક્લેલો છે.

ગર્વ (અહુંકાર, દર્પ) ઉતારવાને કામજ સથળ છે,
કારણુકે કામીને કામ્યવિષય કે વ્યક્તિની અપેક્ષા (પરવા) રહે

છે, અને તેથી તેના આગળ તેનો ગર્વ ગળો જાય છે. કે માણુસને કામવાસના હોય નહિ તો, તેને કશાની અપેક્ષા નહિ રહેવાથી તેનો નિરપેક્ષ ગર્વ નિરંતર વધ્યાંજ કરે. એ કારણુથી શ્રી હરિરાયજી કહે છે કે કામ એ ગર્વ ટાળવાને માટે છે.

**કામેન ભરતસ્યાપિ હરિણત્વં ભવાંતરે ॥
પુરંજનોડપિકામેન સ્ત્રીયોનિમુપલબ્ધવાન् ॥ ૧૮ ॥**

અર્થઃ—કામને લીધે (આસક્તિને લીધે) ભરતજીને પણ અનીજ જન્મમાં હુરણુના હેઠની પ્રાપ્ત થઈ હતી, અને કામથી (વિષયવાસનાથી) પુરંજન રાજને પણ સ્ત્રીનો અવતાર પ્રાપ્ત થયો હતો.

વિવેચન—પુરંજન રાજ સ્ત્રીમાં ધણ્ણો લોલાયો હતો તેથી એને સ્ત્રીનો અવતાર ધારણું કરવો પડ્યો હતો.

ભરતજીની વાર્તા—એક દિવસે ભરતજી શારીરિક ડિયાએથી પાહેંચી ગંડકી નહીને કાંઠે નિત્ય નિયમથી પરવારી ઓંકારનો જપ કરતા એઠા હતા, એટામાં સામે કાઠેથી વાધની ણીકુથી ઢુકેલી એક મૃગલીનો ગર્ભ નહીમાં પડ્યો અને તણાતો તેમણે દીઠા. તે ઉપરથી તેમણે દ્વારાથી આર્દ્ર થઈ તે મૃગલીના તરતના જન્મેલા ખચ્ચાને પાણીમાંથી કાઢી લીધું, અને પછીથી તેનું પાલણું પોષણ તેમણે કરવા માંડયું, અને તેમની ધણી આસક્તિ ખંધાઈ ગઈ, અને તે આસક્તિ એટલી પ્રથમ થઈ કે તે પોતાનું તપ અને ધર્મદિયાએ ભુવ્યા, અને તેથી કરીને તેમને એક પામર મનુષ્યની પેઠે મૃગનો અવતાર આપ્યો. (શ્રીમહ લાગ્વત સ્ક્રિ. ૫-અધ્યાય ૮.)

**કામેન વેદગર્ભોડપિ સ્વસુતાયાં તથાકરોત् ॥
તેનૈવ રાવણો બુદ્ધે રમાયામન્યથાકરોત् ॥ ૧૯ ॥**

અર્થઃ—કામથી ખદ્ધાજીને પણ પોતાની પુત્રી સરસ્વતીને

વષ વષયલાવના થઈ હતી, અને તેજ કામને લીધે રાવણુની પણ સીતાલુ પ્રત્યે વિપરીત બુદ્ધિ થઈ હતી.

વિવેચનઃ—લંકાના રાજ રાવણે શ્રી રામચંદ્રલુની સતી સીતાલુનું હરણ કીધું હતું અને તેમાં તેણે વિષયબુદ્ધિ રાખી તેથી તેના પરિણામે તે અને તેનું આખું કુદુંખ નાશ પાડ્યું હતું. આ કથા શ્રી રામાયણ નામના મહાકાળ્યમાં સુપ્રસિદ્ધ છે.

અધ્યાની કથા—જગતના પિતા અધ્યાની અધર્મથી ભ્રષ્ટ થયેલી બુદ્ધિને લીધે કામના વેગને ન રોકતાં તેને આધીન થદુને દ્વારાદૃષ્ટિથી પુત્રો સરસ્વતી પ્રત્યે જવા રૂપી કૃતિનું આખ્યાન પણ કામની સંગળતા સાખીત કરે છે. (શ્રીમહ ભાગવત સ્ક. ૩ અધ્યાય ૨૨).

એવं હિ બહોનષ્ટાઃ કામેનૈવ હિ સાધવઃ

ભક્તિમાર્ગે વિરોધસ્તુ તત્ત્વ કામઃ કૃતો મહાન् ॥ ૨૦ ॥

અર્થઃ—એવી રીતે ધણુા ધણુા સાધુ પુરુષો કામને લીધે ખુવાર થયેલા છે. વળી લક્ષ્મિમાર્ગને વિષે પણ તે કામનો સંખંધ મહા વિરોધી અથવા શત્રુદ્દ્રિપ છે.

વિવેચનઃ—ઉપર ને દાખલાઓ આચાયા તે ઉપરથી જણ્ણા શ્રી કે કામથી ધણુા સાધુ પુરુષો નષ્ટ થયા છે. લક્ષ્મિમાર્ગને વિષે તો કામનો સંખંધ મહા શત્રુદ્રિપ ગણ્ણાય છે. લક્ષ્મિનાં મુખ્ય વણું અંગ છે. ૧ પ્રલુના માહાત્મ્ય જ્ઞાનની પ્રાપ્તિ, ૨ પ્રલુઉપર સર્વથી અધિક સ્નેહ રાખવો તે, અને ૩ પ્રલુમાં નિરંતર ચિત્તને પરોવવું તે. આ ત્રણે અંગોને કામ ખાંડિત કરે છે.

કેછી કામ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની મનમાં પ્રથમ ધૂઢ્છા ઉત્પન્ન થવાની સાથે પ્રલુનું માહાત્મ્યજ્ઞાન સંપાદન કરવાને, કથા, વાર્તા, વાંચન, લેખન વગેરે પ્રકારે ને વખત ગાળવામાં આવતો હોય, તે વખત એ વસ્તુ પ્રાપ્ત કરવામાં વાપરવાને મન લક્ષ્મયાયા વગર રહેતું નથી.

કામ્ય વિષયરૂપ જે વસ્તુ હોય તે વસ્તુ પ્રાત્ કરવાની જેટલે દરજને પ્રીતિ થાય, તેટલે દરજને ભગવાનું પ્રત્યેની પ્રીતિમાં ન્યૂનતા થયા વગર રહેતી નથી.

જેટલે દરજને કામ્ય વિષયરૂપ વસ્તુ પ્રાત્ કરવામાં ચિત્ત રાખવામાં આવે તેટલે દરજને ભગવાનુંમાં ચિત્તની એકાશ્રતા કરવાનું બની આવતું નથી.

એ રીતે કામ સર્વ પ્રકારે ભક્તિને વિષે શત્રુરૂપ નીવડેછે.

કામિનः ફલવાંછાતઃ શરણं નैવ સિદ્ધ્યતિ ।

સાપેક્ષસ્થતુ સર્વત્ર દુર્લભં હિ સમર્પણમ् ॥ ૨૧ ॥

તદ્ભાવે તદીયત્ત્વં સર્વથૈવ હિ દુર્લભમ् ।

સાધારણ્યેવ બુદ્ધિઃ સ્યાતેન લીલાસ્થિતેષ્વાપિ ॥૨૨॥

અર્થઃ—કામીપુરૂષને ઝુળની ઈચ્છા હોવાથી તેને શ્રીહરિનું શરણું સિદ્ધ થતું નથી; કેમકે ઝુળની અપેક્ષાવાળાને શ્રીહરિને વિષે સમર્પણું કરવાની બુદ્ધિ થવી એ સર્વ પ્રકારે દુર્લભછે. ૨૧

સમર્પણુને અભાવે ભગવાનીયપણું સર્વ પ્રકારે દુર્લભ છે. કામને લીધે ભગવાનની લીલામાં રહેલા લક્ષ્ટાજનોના સંખાંધમાં સાધારણું લેાકિક બુદ્ધિ થાય છે. ૨૨

વિવેચન—કામીપુરૂષને ઝુલની ઈચ્છા હોય છે. એ ઈચ્છા એટલી બધી પ્રથમ હોય છે કે એ ઈચ્છાવાળો મનુષ્ય એ કામનાજ વિષયને પોતાની નજર આગળ નિરંતર હેઠે છે; તે કારણથી એના મનની તમામ વૃત્તિઓનો એ વિષયમાંજ નિરોધ થાય છે. એ પ્રમાણે જેનું મન વિષયમાંજ ગુંથાયદું હોય તે શ્રી હરિનું શરણું શી રીતે પ્રાત્ કરી શકે?

શ્રીહરિનું શરણું પ્રાત્ કરવામાં સર્વ વસ્તુઓ શ્રી હરિને સમર્પણું કરવાની છે, એટલુંજ નહિ પણ શરીર, ઈન્દ્રિયો અને મનના તમામ વ્યાપાર પ્રલુનેજ અર્પણું કરવાની જરૂર છે. જ્યાં સુધી સર્વ વસ્તુઓ ભગવાનને સમર્પણું ન કરી હોય ત્યાં સુધી

પ્રભુનુજ શરણુ, પ્રભુનો આશ્રમ થઈ શકતો નથી. જ્યાં સુધી એમનો આશ્રમ સિદ્ધ ન થાય ત્યાં સુધી એમની પ્રાપ્તિ પણ થઈ શકે નહિ.

સમર્પણુથીજ લગવદીયપણું પ્રાપ્ત થાય છે.

મનમાં જ્યાં સુધી કામવાસના હોય ત્યાં સુધી લગવાનની લીલામાં રહેલા જીવોના સંખાંધમાં મનુષ્યને લૈાંકિક બુદ્ધિ થયા વગર રહેતી નથી. જ્યારે જ્યારે શ્રી હરિની લીલા વિષેની કથા વાર્તા તેઓ વાંચે કે સાંલળે લારે લારે એમના મનમાં એમ વિચાર ઉત્પત્ત થાય કે લગવાન એ એક મહા રાજી કામીપુરુષ છે, એમનો કામ અનિવાર્ય છે, તે કહી પણ તૃપ્ત થતો નથી; આવા વિચારો કામીપુરુષોની રીતભાત ઉપરથી કામીમનમાં ઉત્પન્ત થયા વગર રહેતા નથી. એ વિચાર કરતી વખતે તેઓ ભૂલી જાય છે કે, લગવાનનું લગવાનપણું નિષ્કામતા કે વૈરાગ્ય ઉપર આધાર રાખે છે. જે છ લગ અથવા એક્ષર્યને લોધે પ્રભુને લગવાન કહેવામાં આવે છે તે, ૧ એક્ષર્ય, ૨ વીર્ય, ૩ યશ, ૪ શ્રી, ૫ શાન અને ૬ વૈરાગ્ય છે. સતત વૈરાગ્ય ધારણું કરવાવાળા લગવાનને કામવાસના હોંકજ શકે નહિ, તો એમની લીલામાં એનો ગંધ કે ન્યર્શ હોવાનો સંભવ નથો.

જે જીવો પ્રભુનીજ સેવામાં નિરંતર ગુંથાઈ રહે છે તેઓ પણ લૈાંકિક વિષયની વાસનાવાળા છે એમ લોકો ધારે છે અને તેમના ઉપર અનેક ઘોટા આરોપો મુકે છે. નૃસિંહ મેહેતો, મીરાંખાઈ વગેરે અનેક ભક્તજનોના ઉપર અનેક પ્રકારના આરોપ મુકવામાં આવતા એ વાત સુપ્રસિદ્ધ છે. બ્યવહારમાં પણ એમજ જોવામાં આવે છે.

કામલેન યથા પીતપત્રીતિરલિલે ભવેતુ ।

પંચાધ્યાય્યામતઃ પ્રોક્તં હૃદોગત્વં શુકૈરપિ

॥ ૨૩ ॥

दोषाद्वाद्धिः कायिनस्तु भवेष्टीलाकृतौ हरेः ।

निर्बंधे श्रीमदाचार्यैरत इंद्रियनिग्रहे || ૨૪ ||

अत्यागः सर्वथा प्रोक्तो भगवन्नक्तिसाधकः ।

कौतुकार्थमपि त्यागो धर्मार्थमयि वर्जितः || ૨૫ ||

अर्थः—જે પ્રમાણે કુમળાના લગવાળાને સર્વ વસ્તુમાં પીળા રંગના પ્રતીતિ થાય તે પ્રમાણે લગવલીલાના સંખ્યમાં પણ કામને લીધે તેવી ભાવના અથવા પ્રાકૃત બુદ્ધિ થાય છે, તેથી કરીને રાસપંચાધ્યાયીમાં પણ શુકૃદેવજીએ કામ ને મનનો રાગ કહેલો છે. ૨૩

શ્રીહરિની લીલાના કુતિમાં કામીપુરુષોને હોષબુદ્ધિજ થાય છે, અને તેથી શ્રીમહ વદ્ધભાચાર્યજીએ નિયંધતા અંથમાં ઈન્દ્રિયના નિયંત્રણનો સર્વથા અત્યાગ કર્યો છે, એટલે ઈન્દ્રિયોનો સર્વથા નિયંત્ર કરવાનો કહેલો છે, કેમકે ઈન્દ્રિયનિયંત્ર લગવઙ્ઘ-ભક્તિનો સાધક છે. વળી શ્રી આગ્રાર્યગ્રંથ કુરીથી કહે છે કે ઈન્દ્રિયનિયંત્રનો ત્યાગ કોતુકને અચે પણ કરવા નહિ, તેમજ ધર્મના અર્થમાં પણ ઈન્દ્રિયનિયંત્રનો ત્યાગ કરવા નહિ. ૨૪-૨૫.

વિવેચન—જે માણુસને કુમળો થયો હોય તે સર્વ વસ્તુને પીળી હોય છે એજ પ્રમાણે કામી મનુષ્યો લગવાનની લીલાને કામદૂપ હોય છે એ મોટી ભૂલ છે.

જે અનંત ઊર્ધ્વાંડોને રંધે છે, જે સર્વ પ્રાણીઓના આત્મા છે, જે સર્વ પ્રાણીમાત્રના માતા પિતા છે તે કામી હતા અને હોષબુદ્તા કામીપુરુષો તરીકે વર્ત્યા હતા એ કહેવું અયોગ્ય છે.

લગવાનના અપ્રાકૃત લીલાઓનો ખરો અર્થ એમના કૃપા-પાત્ર લક્ષ્યતોજ સમજાવી શકે છે. એ લીલાઓ સંખ્યી પ્રાકૃત બુદ્ધિ કરવી અધિત છે.

લગવાન શ્રી કૃષ્ણની આસુરહમન, વસ્તુરણ, રાસલીલાદિ

लीलायोनुं परम रहस्य जाणुवा माटे श्रीमदाचार्यजु वक्तुलाचार्यजु कृत भागवत उपरनां “सुषेधिनी” टीका अथवा ते आधारे (प्रसिद्धकर्ताचे गुजरातीभां रचेलां) “कृष्ण लीलामृत ” जेवां.

काम ए भाव शरीरनोऽ रोग नथी पणु मननो ए रोग छे, केमडे अभीपुढेचे खीजने पणु तेवी भावनावाणा जुचे छे अने भगवाननी शुद्ध लीलाभां पणु तेवी भावना लेण्वे छे माटे शुक्कहेवलु एने इहयनो रोग कडे छे.

श्रीमदाचार्यजु नियंधना सर्वनिर्णय प्रकरणमां अडे छे के-

स्वधर्माचरणं शक्तया विधर्माच्च निर्वतनम् ॥
इंद्रियाश्वविनिग्राहः सर्वया न त्यजेत् ब्रयम् ॥

अर्थः—शक्ति प्रभाणे स्वधर्मनुं आचरणु करे, विभुग्म करनार विधर्मथी फूर रहो, इंद्रियोऽपि घोडाने वश राखो. आ त्रणे वस्तुनो केंद्र हिवसं त्याग करो नहि.

स्वयामिंद्रियकार्याणीत्युक्त्या धैर्यविभंजनः ॥
विवेकस्य विरोध्येव तदस्फूर्तिकरो यतः ॥२६॥
आश्रयस्तु कथं सिध्येन्मनोविक्षेपसंभवात् ॥
भक्तिमार्गेऽपि मूलत्वात्यागस्य न हि सिध्यति ॥२७॥

अर्थः—स्वयामिंद्रियकार्याणि ए वाक्यवडे शुक्तिपुरःसर ज्ञानाववाभां आ०युं छे के (काम) धैर्यने तोडनार छे, अने ते विवेकनो विरोधी डोवाथी तेने लीघे विवेकनी अस्कुर्ति (विस्मृति) थाय छे. २६

ए प्रभाणे विवेकनो नाश थतां मनमां विक्षेप थवाथी भगवद्वाश्रय सिद्ध थट्ठ शके नहि. इन्द्रियविषयनो त्याग ए शुक्तिमार्गनुं भूण कारणु डोवाथी इन्द्रियोना विषयोना त्यागना अलावे शुक्तिमार्ग सिद्ध थतो नथी. २८

વિવેકનઃ—વિવેકધૈર્યશ્રદ્ધાય નામના “ અંથમાં શ્રીમહાર્ય-
ચરણુ કહે છે કે—

સ્વયમિદ્રિયકાર્યાણિ કાયવાળુંપનસા ત્યજેતુ ॥

અર્થઃ—“ ધન્દ્રયોનાં પોતપોતાનાં કાયોનેકાયાથી, વાણીથી
અને મનથી તજવાં” એ વાક્ય ઉપરથી રૂપી રીતે સમજાય છે
કે જે ધન્દ્રયો પોતપોતાના વિષયોમાં વળગી રહે તો તેથી
ધૈર્યનો લંગ થાય.

ધૈર્ય એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ અથવા આધ્યા-
તિમક આધિલૈાતક અને આધિદૈવિક એ ગણે પ્રકારનાં હુઃએને
સર્વ પ્રકારે સર્વદા સહન કરવાં, તથા ખો પુત્રાદિક તરફથી થતી
હેરાનગતિ સહન કરવી તે.

દરેક ધન્દ્રયને પોતાના પ્રિય વિષયની પ્રાપ્તિ ન થતાં
હુઃખની લાગણી થાય છે. એ હુઃખની લાગણીએ સહન કરી
દરેક ધન્દ્રયોનો નિશ્ચહુ કરવો એ અભિજ્ઞાનમાં આવરણક છે.
એમ કરવામાં ન આવે તો ધૈર્યનો નાશ થાય.

વળો કામ એ વિવેકનો વિરોધી છે. વિવેક એટલે પ્રભુ
સર્વ વસ્તુ પોતાની પ્રચ્છા પ્રમાણે કરશો તેવી સમજ. સર્વ વસ્તુ
કરવાને તે સમર્થ છે, અને શું કરવાથી પોતાના ભક્તાજનો સુખી થશે
એ વાત પોતેજ સારી પેઠે જાણે છે, મારો અમુક વરતુ કરવાની
એમને પ્રાર્થના કરવી એ ઉપયોગી નથી, આપત્તિ, ભતિ વગેરે
કર્માને વિષે હુઠનો ત્યાગ કરવો, અને ધર્મ અધર્મનોજ માત્ર
વિચાર કરી અલિમાનનો ત્યાગ કરી લૈકિક વસ્તુ કરવાના આ-
શહુને છોડી હુઈ સર્વથા પ્રભુની પ્રચ્છાને આધીન થવું, એ પ્ર-
માણેની વર્તણુકને વિવેક કહે છે.

કામી મનુષ્ય હુમેશ પોતાની મરજુ પ્રમાણે વર્તવાના
આશહુવાળો હોય છે, એ કારણથી ઉપર કહ્યા પ્રમાણેનો એ-
નામાં વિવેક હોઈ શકતો નથી.

विवेक अने धैर्य होय तो भन विशेष वग्रतुं थाय.
 ए अन्नेनो नाश थतां प्रलुनो ६६ आश्रय राखवानुं सामर्थ्य
 शी रीते आवी शके ? प्रलुना उपरकै द्रुद आश्रय राखवो ए
 वात निश्चित अने एकाश्र भन सिवाय अनी शके नहि. ज्यां
 सुधी भन एक विषय उपरथी भीजा विषय उपर अने भीजाथी
 श्रीजा उपर लटकतुं होय त्यां सुधी तेनामां आश्रय राखवा
 जेटली स्थिरता रहे नहि. लक्षितमार्गमां विवेक, धैर्य अने आ-
 श्रयथी श्रूत सिद्ध थाय छे; ते सर्वनो शान्तु काम छे. ए रीते
 काम ए सर्व प्रकारे लक्षित मार्गनो विरोधी छे एम भताव-
 वामां आ०युं छे. अथकृता कहेछे के उन्निद्रियना विषयेनो त्याग
 ए लक्षितमार्गनुं एक आवश्यक तत्प छे. ए तत्प्राप्ति कर्या
 सिवाय लक्षितमार्गज सिद्ध थहि शकतो नथी.

बाह्यपक्षे कृष्णयोगः सर्वथा त्वांतरं मतः ॥

परं तूभयथात्यागो मूलमत्र न संशयः ॥ २८ ॥

कामे सति कथं त्यागः सापेक्षस्य प्रसिद्ध्यति ॥

तस्माद्विचार्य तदूपं दुरतिक्रमणं स्वतः ॥ २९ ॥

शरणीकरणीयं श्रीनिजाचार्यपदांबुजम् ॥

साधनानामभावेऽपि स्वबलाऽखिल साधकम् ॥ ३० ॥

तत एव च निस्तारो दोषपोषयुतान्मनाम् ॥

नान्यागतिर्गोकुलेशभजनानंदकांक्षिणाम् ॥ ३१ ॥

इति श्रीहरिशास्त्रविरचितं कामाख्यदोष विवरणं संपूर्णम्

अर्थः—उन्निद्रियेनो विषयेनो अहारथी त्याग कृपणुना ये-
 अनी प्राप्ति करे छे अने आंतर त्याग होय तो सर्वथा श्री
 कृष्णनी प्राप्ति धायज एम भानवामां आ०युं छे. तेथी उन्निद्रिय
 विषयेनो बाह्य अने आंतर त्याग लक्षितमार्गनो भूल पाये-
 छु एमां कांहि संशय नथी. २८.

ને કામવાસના વ્યાપ્ત હોય તો મુમુક્ષુને ત્યાગની સિદ્ધિ થી રીતે થઈ શકે ? કેમકે કામ એ બીજુ વસ્તુઓની પૂર્બિણા-વાળો છે. તેટલા માટે કામના ઝૂપનો વિચાર કરીને તે (કામરૂપી) પાપનું ઉદ્ઘાંધન કરવાને માટે શ્રી નિબાર્યાર્થના* ચરણારવિંદનું શરણ લેવું જોઈએ. એ ચરણારવિંદ કામના વિજયને વિષે સાધનનો અલાવ હોય તો પણ પોતાના બણથી સર્વ કરવાને સમર્થ છે. ૨૯-૩૦

તેથી કરીને શ્રી આચાર્યનું ચરણ સર્વ પ્રકારના હોષેયુક્ત મનુષ્યનો નિસ્તાર કરનાડું છે અને લગ્વાનું લજનાનંદની આકંક્ષાવાળાને માટે એજ માર્ગ (ગતિ) છે. બીજો કોઈ માર્ગ નથી. ૩૧

વિવેચન—ઇન્દ્રિય વિષય ત્યાગના શ્રી હરિરાયજુ એ ભાગ પાડે છે, એક ભાગ ત્યાગ અને એક આંતર ત્યાગ. ભાગ ત્યાગ એટલે કામ્ય વિષયનો ભાહોપકરણ (હેડ, ઇન્દ્રિય પૂર્ણ) થી ત્યાગ, આંતર એટલે આંતરોપકરણ (વૈરાગ્ય) થી ત્યાગ.

મંદ્વાડના વખતમાં માંહો માણુસ અમુક પદ્ધાયો. તજે છે એ અહારનો ત્યાગ છે. એ પદ્ધાયો તજવાથો એ પદ્ધાયોપરનો ઝચ્ચિ કે પ્રીતિનો જ્યારે નાશ થાય ત્યારે આંતર ત્યાગ થયો કહેવાય.

કામ્ય વિષયનો અહારથી પણ ત્યાગ કરવો એ કાંઈ સહેલું કામ નથી અને તે નિરથી પણ નથો, કેમકે તેવા ત્યાગથી પ્રીતિમાં વધારે થતો અટકે છે અને કાગાંતરે તે પ્રીતિ નષ્ટ પણ થાય છે. પ્રભુ તરફ વળોવા મનને એ ત્યાગથી પ્રભુ તરફ વધારે વાળવાને વખત મળે છે, અને તેને લાધે શ્રીકૃપણુનો યોગ, શ્રીકૃપણુની ભક્તિ, ઉત્પન્ન થાય છે. ને વિષયનો આંતર ત્યાગ થાય એટલે તેઓની પૂર્બિણા મૂલનું પણ છેદન થાય તો ભક્તિ ઉત્પન્ન થયા વગર રહેજ નહિ.

* શ્રીમહવક્ષભાર્યજ્ઞનું શરણ.

ધુન્દિયવિષયોનો ખાડારથી અને અંદરથી ત્યાગ કરવો એ લક્ષ્ણમાર્ગનો મૂળ પાયો છે એમાં સંશય નથી.

પોતાના આચાર્ય (શ્રીમહાવક્તિલાચાર્યજી) નું સમરણું કરવાથી તેમના ઓધ અને વચનો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી તે પ્રમાણે વતોંવાથી, કામડુપી પાપનું ઉલ્લંઘન થઈ શકે છે.

આ કૃપણુના ભજનાનંદની આકંક્ષાવાળાને મારે તો શ્રીમદ્દાચાર્યચરણ-એમનો ઓધ-એમના ગ્રંથો-એમનું ચરિત્ર વગેરે કામના વિષયોના લાગનો ખાણતમાં વિજય પ્રાપ્ત કરાવવાને સમર્થ છે.

શ્રીમહાચાર્ય (શ્રીમહાવક્તિલાચાર્ય) શ્રીકૃપણુના મુખાંજિનુંપણ છે, એટલે નિત્યજ વિરાજમાન છે. કામ લક્ષ્ણમાં પ્રતિખંધ રૂપ છે, એટલે એનું દમન કરવાની આવસ્થાકર્તાજ છે. જીવથી તે ખની શકે નહિ તો એ કામને પણ અશાન કરી જાય. એવા આચાર્યશ્રીના મુખાંજિનો આશ્રય કરવો, કે જેથી કામ જીતાઈ રૂલાતમક શ્રી કૃપણુના સ્વરૂપની પ્રાપ્તિ થાય.

પતિ શ્રી હરિરાયજીએ રચેલું કામાખ્યહોષ વિવરણ

ટીકા સહિત સમાપ્ત.

સર્વોત્તમ વિદેશી વિદેશ.

१. પાલાંદી મિલાન પ્રકાશ પટેલ: ગીતાથી
(બાધાંતર પ્રકાશ અને આપરાણિયાન નામની
નીકના સારસાચે). કો. ૩. ૫
 ૨. શ્રીમહ વલલાચાર્યજી (આચાર્યજી મહાગ્રંથ) તુ. એવિહાસિક જીવન-ચરિત્ર. (ભડિનમાર્ગ તથા
શુદ્ધાર્દેશ-ચિદાંત ઈ. સંખ્યા સપ્રમાણ અને સરદ
વિવેચન સાચે.) કો. ૩. ૨).
 ૩. શ્રી કૃષ્ણલીલાસુત પ્રથમ લાગ. (પરમાત્મા શ્રી
કૃષ્ણના અવતારની લીલાઓનું પરમ રહુસ્ય
જાળવનાર અધ્યૂર્વ ચાચે). કો. ૩. ૧)
 ૪. માલા પ્રસંગ. (શ્રીમહ ગોસ્વામી ગોકુળનાથજીના
અપ્રતિમ સ્વર્ઘમાં રક્ષણુનો ધતિહાસ). કો. ૩. ૦।
 ૫. શ્રી હરિરાયજી કૃત કામાણ્ય દોષ વિવરણ, (મૂળ
બાધાંતર તથા વિવેચન સાચે). કો. ૮-૨-૦
 ૬. શ્રીમહ વલલાચાર્યજીના જીવન, તત્ત્વવિદ્યા અને
ઉપરોક્ષ સંખ્યા વ્યાખ્યાન (કલકત્તાની કન્વેન્શન
ઓઝ રીલોલથ-સમાં આપેલું) ઈજીજ તથા
ગુજરાતી હરેકની કો. ૦-૨-૦
 ૭. શ્રીમહ વલલાચાર્યજી પ્રતિપાહિત શુદ્ધાર્દેશ ચિ-
દાંત (ગ્રીલ સાહિત્યપરિપ્રહભાં આપેલું વ્યાખ્યાન). કો. ૦-૨-૦
- ભાગનાં ડેકાણાં:— એન. એમ. ન્રિપાતીની કુ. સુંધરી.
- શુદ્ધાર્દેશી પંચની ઓશ્રીસ. અમન્દારાદ.
અંદોશાસ મુકુદજી-કાલખાહેરી—સુંધરી.
બીજીની પુસ્તકો વેગનારને લાં
- ઉપરના પુસ્તકો તથા વેણું ધર્મ સંખ્યાનાં હરેક પુસ્તક નારીઓનું
શ્રી પુસ્તકાલયનાં શ્રીલોવનદાસ પીરોખરદાસ થાડ, પાસેથી
મધ્ય અધરે.